

Date: February 16, 2024

To,
BSE LIMITED
P.J. Towers,
Dalal Street,
Mumbai-400001

Sub.: Newspaper Advertisement for Un-Audited Standalone and Consolidated Financial Results of the Company for the Quarter and Nine Months ended on December 31, 2023
BSE Scrip Code: 513430


Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached the newspaper advertisement of the Un-Audited Standalone and Consolidated Financial Results of the Company for the Quarter and Nine Months ended on December 31, 2023 published in the Free Press Gujarat in English Newspaper and Lokmitra in Gujarati Newspaper containing extract of Un-Audited Financial Results as per regulation 33 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Kindly take the same in your record.

Thanking you,

Yours faithfully,
FOR, MAITRI ENTERPRISES LIMITED



JAIKISHAN R. AMBWANI
MANAGING DIRECTOR
DIN: 03592680

We are the only country to have brought in General Network Access, no other transmission system in the world can match ours: Union Minister for Power and New & Renewable Energy

The Union Minister for Power and New & Renewable Energy Shri R. K. Singh said that the power sector of India is the place to be in and invest, given the fast growth of the Indian economy and of the power sector now and in the years to come. "There is no other economy which is as big and large as us. And we need power to grow. The electricity generation and consumption has gone up by 60% as compared to 2014-15. The per capita consumption has gone up by almost that much. Compared to last year, we have grown by 8%. Hence, this is a sector which will reward you. The demand will continue to keep growing and our challenge is to ensure that supply keeps pace with the demand." The Minister said this while addressing the inaugural session on "The Global Energy Agenda: A look ahead in Shaping Tomorrow's Energy Landscape", of ET Now Global Business Summit organized by The Times Group, in New Delhi on February 10, 2024. Speaking about the transformation in the power sector, the Power Minister told the business community that earlier, the private sector had decided to not invest. "But now, nobody wants to sign long-term Power Purchase Agreements since the market is up and more remunerative, thus yielding steady investments into the sector." If power sector had not grown as much, our economy would not have been able to grow as we do now, added the Minister. Shri Singh explained that the government made the system transparent, with automatic payment mechanism for power suppliers. "Earlier, we had almost about 70 GW of power capacity which was financially stressed. This was because state governments used to announce subsidies but not pay them, the collection and billing efficiencies were low. Outstanding dues of genscos were about Rs. 1.5 lakh crores. Payments to power

suppliers used to be in installments of 6-8 months. AT&C losses were about 27%. ACS-ARR gap was about one rupee." The Power and New & Renewable Energy Minister said that the government has turned around the sector and that it will continue to grow. "We brought down AT&C losses to around 15% and ACS-ARR gap has come down to 15 paise last year. Legacy dues of genscos have come down to Rs. 42,000 crores, and this too will be wiped out in around 7-8 months, while current dues are paid in full. Average daily availability of power in rural areas has gone up from 12.5 hours in 2015 to around 22.5 hours today. In urban areas, it is now around 23.8 hours." Shri Singh explained that he has tried to insulate the system from politics and to check the use of electricity as a political tool such as through announcing freebies. "My message is that somebody has to pay for power and we have put in place Rules which enforce this, so that subsidy is accounted, that if the subsidy money is not given in advance, then subsidy will not be passed on. We made everything conditional; if you do not pay for power, you do not get power." Speaking about the performance of power sector PSUs, the Minister said that their share prices have gone up by 2.5-3 times in recent years and that they will keep growing, since the power sector is where the demand is growing to grow and where we are doing new things and evolving. Replying to a question on how the turnaround has been brought about, the Minister said that our staff is talented - the PSUs recruit some of the best people in the industry, pay them very well, provide them very good working conditions and give them the confidence to take decisions. "I have encouraged officers to take decisions, telling them that if you make a mistake, I don't mind. It is only people who decide

who make mistakes. And I assume that my officers have made bona fide decisions, unless a mala fide intention is proved. I have tried to give confidence to my officers to go ahead and decide." The Minister said that the institution of dispute resolution mechanisms has been another reform measure. "We sidetracked the normal arbitration mechanism which takes 6-7 years and put in place a dispute resolution mechanism. This was a major hurdle in hydro projects where we have geological surprises, leading to disputes. As a result, decision-making has become faster." Shri Singh said that with peak electricity demand having gone up from 136 GW in 2014 to more than 240 GW today, the government is racing to add additional power capacity.

WESTERN RAILWAY - VADODARA DIVISION
TENDER NOTICE (NIT)
The following tenders are invited by the Divisional Railway Manager (Mechanical), Western Railway, Pralapanagar, Vadodara - 390004.
TENDER NO. M443-MV-KRCA-2024, Name of Work: Outsourcing of master valve assembly overhauling/maintenance work during ROH of BTPN wagons at Wagon depot Karachiya of Vadodara Division, Western Railway for a period of 1 year. **Estimated cost of work:** ₹ 26,58,474/- **Earnest Money deposit:** ₹ 53,200/- **Date & time of submission of tender:** Not later than 15:00 hrs. of 05/03/2024 in prescribed manner. **Date & Time of Opening:** On the last date of submission i.e. 05/03/2024 at 15:30 hrs. **Validity of offer:** 60 days from the date of opening. **Completion period:** 12 month. **Website details:** <https://www.reps.gov.in> 328
Like us on: [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

ELEANOR INDUSTRIES LLP
LLPIN: AAK-7722
(Registered under the Limited Liability Partnership Act, 2008)
Address: Survey No. 656, Nr. Jaliyamath Station, AT: Sampa, TA: Gandhinagar - 382305, Gujarat

Form No. URC-2
Advertisement giving notice about registration under Part I of Chapter XXI of the Act (Pursuant to section 374(b) of the Companies Act, 2013 and rule 4(1) of the Companies (Authorized to Register) Rules, 2014)

- Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application is proposed to be made after fifteen days hereof but before the expiry of thirty days hereof after to the Registrar at Central Registration Centre (CRC) that M/S. ELEANOR INDUSTRIES LLP - (LLPIN: AAK-7722), a Limited Liability Partnership (LLP) may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013, as a Company limited by shares.
- The principal objects of the proposed Company are as follows:
 - To carry on the business in India or abroad to carry on the business as manufacturers, buyer, reseller, trader, importers, exporters, processors, metal extruders, drawers machinists metal works, fitters, wire drawers, founders, importers, dealers and traders in all kinds of aluminum, aluminum coils, H.R. coil, slit coil and strip from HR/CR/SP/SS coils, brass, copper, bronze, lead zinc including busbars, flats, sheet, tubes, profiles wire extruded and rolled sectioned square plates of all sizes pipes rods, strips, foils, channels, bolts, nuts, rivets and also to carry on the business of packaging, melting, extruding, drawing, slitting, edgmillng sheeting, stamping, pressing, flattening, straightening forgoing and heat treatment of all aluminum whether in India or abroad.
 - To take over ELEANOR INDUSTRIES LLP
- A copy of the draft Memorandum and Articles of Association of the proposed Company may be inspected at the office at Survey No. 656, Nr. Jaliyamath Station, AT: Sampa, TA: Gandhinagar - 382305, Gujarat.
- Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at Central Registration Centre (CRC), Indian Institute of Corporate Affairs (IICA), Plot No. 6,7,8, Sector 5, IMT Manesar, District, Gurgaon, Haryana - 122050, within twenty-one days from the date of publication of this notice, with a copy to the Company at its registered office.

Dated this 16th February, 2024
Place: Gandhinagar

For ELEANOR INDUSTRIES LLP Sd/-
DINESH RAJPUROHIT Designated Partner
DPIN 07955102

For ELEANOR INDUSTRIES LLP Sd/-
NARESHBHAI PATEL Designated Partner
DPIN 07568618

ICICI Home Finance
Corporate Office: ICICI Home Finance Company Limited ICICI HFC Tower, Andheri - Kurla Road, Andheri (East), Mumbai - 400059, India
Branch Office: 4th Floor, 410, Milestone Vibrant, Opp. Apple Hospital, Udhna Darwaja, Surat- 395002
Branch Office: Unit No. 03, 1st Floor, Shanti Complex, Plot No P-50/1, G.I.D.C. B/H, 21st Century Hospital, Vapi- 396195

Notice for sale of immovable assets
E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the Physical Possession of which has been taken by the Authorized Officer of ICICI Home Finance Company Ltd., will be sold on "As is where is", "As is what is", and "Whatever there is", as per the brief particulars given hereunder:

Sr. No.	Name of Borrower(s)/ Co-Borrowers/ Guarantors/ Legal Heirs. Loan Account No.	Details of the Secured Asset (s) with known encumbrances, if any	Amount Outstanding	Reserve Price Earnest Money Deposit	Date and Time of Property Inspection	Date & Time of Auction
(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)
1.	Janmajay Das (Borrower) Titattama Das (Co-Borrower) Loan Account No. LHSUR00001313059	Flat No B/107on First Floor in "B" Wing known as "Somnath Residency", in Mauje Jolva, Surat Lying being land bearing Block No. 88, Plot No. 111 to 117, Block No. 93, Plot No. 5 to 12, Near Anmol Residency Surat at Registration District & Sub District Palasna & District Surat- 394310	Rs. 9,37,412/- February 05, 2024	Rs. 3,46,421/- February 05, 2024 Rs. 34,650/-	February 20, 2024 11:00 AM 03:00 PM	March 05, 2024 02:00 PM 03:00 PM
2.	Yogeshkumar Bind (Borrower) Pankali Devi (Co-Borrower) Loan Account No. LHVPI00001293878	Flat No. F-1/103, on the First Floor of the Building-F1, Known As "Shiv Shakti Township", Old. S. No.88, New S. No.379, At Saran Tal. Pardi, Dist. Valsad-396185	Rs. 23,69,320/- February 05, 2024	Rs. 14,00,000/- February 05, 2024 Rs. 1,40,000/-	February 20, 2024 11:00 AM 03:00 PM	March 05, 2024 02:00 PM 03:00 PM

The online auction will be conducted on website (URL Link- <https://BestAuctionDeal.com>) of our auction agency **GlobeTech**. The Mortgagors/notice are given a last chance to pay the total dues with further interest till **March 04, 2024 before 05:00 PM** else these secured assets will be sold as per above schedule. The Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/ Demand Draft (DD) (Refer Column E) at **ICICI Home Finance Company Limited, 4th Floor, 410, Milestone Vibrant, Opp. Apple Hospital, Udhna Darwaja, Surat- 395002** on or before **March 04, 2024 before 04:00 PM**. The Prospective Bidder(s) must also submit signed copy of Registration Form & Bid Terms and Conditions form at **ICICI Home Finance Company Limited, 4th Floor, 410, Milestone Vibrant, Opp. Apple Hospital, Udhna Darwaja, Surat- 395002** on or before **March 04, 2024 before 05:00 PM**. Earnest Money Deposit Demand Draft (DD) should be from a Nationalized/Scheduled Bank in favor of "ICICI Home Finance Company Ltd. - Auction" payable at **Surat, Valsad**. For any further clarifications with regards to inspection, terms and conditions of the auction or submission of tenders, kindly contact **ICICI Home Finance Company Limited on 9920807300** or our **Sales & Marketing Partner NexGen Solutions Private Limited**. The Authorized Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons. For detailed terms and conditions of the sale, please visit <https://www.icicifhc.com/>
Date : February 16, 2024
Place : Surat, Valsad
Authorized Officer
ICICI Home Finance Company Limited

Surat get 37% result in CA foundation, Ritika tops lists

Surat: City's students again have performed well in their CA exams. In the examinations, 1,080 out of 2,902 students have cleared the foundation exam held in December last year. Surat's Ritika Gupta has topped the city by getting 352 marks, while city as a whole has got 37.21% result as against the national result of 30%. Students from Ravi Chhawharia's Institute have secured five top spots in the city. They include Ritika Gupta (352), Vicky Patel, Jeet Magvani (345), Prapti Tredeviya (343) and Krish Jain (340). Panoramic Education's

Manan Chheda (340) also secured fifth place in city.

SMFG Grinhashakti | **SMFG India Home Finance Co. Ltd.**
(Formerly Fullerton India Home Finance Co. Ltd.)
Regd. Office: 3rd Floor, 165 Megh Towers, PH Road, Madhavrayal, Chennai - 600095.
Corporate Office: 503-504, Level 5, Inspire BKC, Main Road G Block, BKC, Bandra East, Mumbai - 400051 | CIN: U65922TN2010PLC076972
grinhashakti@grinhashakti.com | www.grinhashakti.com

TO WHOMSOEVER IT MAY CONCERN
This is to inform that we are shifting operations of the following branch for operational requirements with effect from 16th May, 2024.
Name of the Branch: Rajkot (Gujarat) | **Postal Address:** 1st Floor, Crystal Mall, Nr KVK Circle, 150 Feet Ring Road, Rajkot - 360005.
We have made alternate arrangement for the customers and others connected to this branch to be served by the under mentioned branch.
Name of the Branch: Rajkot (Gujarat) | **Postal Address:** 2nd Floor, The City Centre, Office No. 239, 240 & 241, Near Amrapali under Bridge, Raiya Road, Rajkot, Gujarat - 360007.
For SMFG India Home Finance Co. Ltd. (Formerly Fullerton India Home Finance Co. Ltd.)
Authorized Signatory

SIKKO INDUSTRIES LIMITED
CIN: L51909GJ2000PLC037329
Regd. Off: 508 Iscon Eligance, Nr. Jain Temple, Nr. Prahladnagar Pick Up Stand, Vejalpur, Ahmedabad - 380051
Website: www.sikkoindia.com; Email: compliance@sikkoindia.com
Phone No.: +91 79 6616 8950/66168951

NOTICE OF THE EXTRA ORDINARY GENERAL MEETING OF THE COMPANY, CUT DATE AND E-VOTING
NOTICE is hereby given that, in accordance with the General Circular No. 14/2020 dated April 8, 2020, the General Circular No. 17/2020 dated April 13, 2020, the General Circular No. 11/2022 dated December 28, 2022 and General Circular No. 09/2023 Dated September 25, 2023 (hereinafter collectively referred to as "MCA Circulars") issued by Ministry of Corporate Affairs ("MCA") for holding of Extra Ordinary General Meeting through VC or OAVM without the physical presence of Members at a common venue, the Extra Ordinary General Meeting (EOGM) of the Members of Sikko Industries Limited will be held on Friday, March 08, 2024 at 03.00 p.m. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Special Business as set out in the notice of EOGM.

In accordance with the above mentioned MCA Circulars and SEBI Circular No. SEBI/HO/CFD/CIR/P/2022/62 dated May 13, 2022, the Notice of EOGM is being sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company / Depositories as on Friday, February 09, 2024. Member may note that Notice has been uploaded on the website of the Company at www.sikkoindia.com, website of NSE Limited at www.nseindia.com and website of National Securities Depository Limited (NSDL) i.e. www.evoting.nsdl.com.

In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice EOGM could not be serviced, may temporarily get their e-mail addresses registered with the Company where (1) in case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to compliance@sikkoindia.com; (2) in case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to compliance@sikkoindia.com; or (3) alternatively member may send an e-mail request to evoting@nsdl.com for obtaining User ID and Password by proving the details mentioned in Point (a) or (b) as the case may be.

Post successful registration of the e-mail address, the shareholder would get soft copies of notice of EOGM and the procedure for e-voting along with the user-id and the password to enable them for e-voting in respect of EOGM. In case of any queries, shareholder may write to the Company at compliance@sikkoindia.com. Shareholders are requested to register/ update their complete bank details and Email Ids with their Depository Participant(s) with whom they maintain their demat accounts if shares are held in dematerialized mode by submitting the requisite documents.

There being no physical shareholders in the Company, the Register of members and share transfer books of the Company will not be closed. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the Cut-off date i.e. Friday, March 01, 2024, shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting system on the date of the EOGM.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the EOGM to its Members in respect of the businesses to be transacted at the EOGM. For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating voting through electronic means.

The remote e-voting will commence on 9:00 a.m. on Tuesday, March 05, 2024 and will end on 5:00 P.M. on Thursday, March 07, 2024. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility of e-voting shall be made available at the EOGM; and c) the members who have cast their vote by remote e-voting prior to the EOGM may also attend the EOGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/ e-voting is provided in the Notice of the Extra Ordinary General Meeting.

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of EOGM and holding shares as on the cut-off date i.e. Friday, March 01, 2024, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.com or compliance@sikkoindia.com. However, if you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot Password" option available on www.evoting.nsdl.com.

In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request at evoting@nsdl.com. Members may also contact Mrs. Dhruviktara Pareshbhai Mandviya, Company Secretary and Compliance officer, at the registered office of the Company or at Email id: compliance@sikkoindia.com or on +91 95120 23804 for any further clarification.

Members can attend and participate in the Extra Ordinary General Meeting through VC/OAVM facility only. The instructions for joining the Extra Ordinary General Meeting are provided in the Notice of the Extra Ordinary General Meeting. In case the shareholders/members have any queries or issues regarding participation in the EOGM, you can write an email to evoting@nsdl.com or Call at: - Tel: 1800 1020 990 and 1800 22 44 30. Members attending the meeting through VC/OAVM shall be placed for the purposes of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

For, Sikko Industries Limited
Sd/-
Jayantibhai M. Kumbhani
Managing Director (DIN : 00587807)

SHRIRAM Finance
Shriram Finance Limited
(Earlier known as Shriram City Union Finance Limited).
Reg. Off.: 14A, Sri Towers, South Phase, Industrial Estate, Guindy, Chennai-600 032;
Branch Off: office No.A202, 2ND Floor, Neptune prime, Next to ABS tower, Old Padra oad, Vadodara - 390007 Website: www.shriramfinance.in

DEMAND NOTICE
Note: "It is informed that "SHRIRAM CITY UNION FINANCE LIMITED" has been amalgamated with "SHRIRAM TRANSPORT FINANCE LIMITED" as per order of NCLT, Chennai. Subsequently the name of "SHRIRAM TRANSPORT FINANCE LIMITED" was changed as "SHRIRAM FINANCE LIMITED" with effect from 30.11.2022 vide Certificate of Incorporation pursuant to change of name dated 30-11-2022."

Whereas the borrowers/co-borrowers/guarantors/ mentioned hereunder had availed the financial assistance from SHRIRAM FINANCE LTD (Earlier known as SHRIRAM CITY UNION FINANCE LTD). We state that despite having availed the financial assistance, the borrowers/guarantors have committed various defaults in repayment of interest and principal amounts as per due dates. The account has been classified as Non-Performing Asset in accordance with the directives/guidelines issued by Reserve Bank of India, consequent to the Authorized Officer of SHRIRAM FINANCE LTD. under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 & in exercise of powers conferred under Section 13(2) read with Rule 3 of Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices on respective dates mentioned herein below under Section 13(2) of SARFAESI Act, 2002 calling upon the following borrowers /guarantors /mortgagors to repay the amount mentioned in the notices together with further interest at the contractual rate on the amount mentioned in the notices and incidental expenses, cost, charges etc until the date of payment within 60 days from the date of receipt of notices.

The notices issued to them on their last known addresses have returned /un-served and as such they are hereby informed by way of public notice about the same.
The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Borrower/Co-Borrower/ Name & Address	Outstanding Amount	Property Address of Secured Assets
1. Shiv Shakti Corporation Through its prop. Amitkumar H Pandya Vatva Seva Sahakari Mandali, Godown No. 3, Nr. Rajguru Factory, Vatva Gam-382440	Rs. 63,64,683/- (Sixty Three Lakh Sixty Four Thousand Six Hundred Eighty Three Only) as on 07th February 2023, under loan account No.CDAH1LP2102 270003	Property no. 1 RESIDENTIAL PROPERTY BEARING BUNGALOWS/BLOCK NO. 9-3 (ADMEASURING 188 SQ. YARDS, PLOT AREA & CONSTRUCTION THEREON) SITUATED ON SUB PLOT NO. 9 PAIKI, IN THE SCHEME KNOWN AS "JAYANT PARK", SITUATED AT REVENUE SURVEY NO. 189 & 190/1 PAIKI, MOUJE: RAJPUR - HIRPUR, TALUKA: MANINAGAR, DIST. & SUB DISTRICT: AHMEDABAD. Boundaries (As per Draft Copy of Sale Deed & By Physical Verification at site) North : Sub Plot No. 8, South: Road East: Sub Plot No. 9/2, West: Sub Plot No. 9/4,
2. Amitkumar H. Pandya 636/774 RAMDAS SHERI NR AZAD CHOWK VATVA AHMEDABAD,VATVA GUJARAT,VATVA,DASCROI,GUJARAT,382440		
3. Gitaben Pandya 636/774 RAMDAS SHERI NR AZAD CHOWK VATVA AHMEDABAD,VATVA GUJARAT,VATVA,DASCROI,GUJARAT,382440.		
4. Manisha Dipakbhai Ravai 1/10, Kankaria Municipal Officers Flat, Kankaria, Ahmedabad: 380022	Rs. 80,00,000/- in CDAH1LP210227 0003	
Loan Amount		
NPA DATE- 3rd February 2024		
Date Of Demand Notice: 6th February 2024		
Owned by Amit Hasukhbhai Pandya		

In the circumstances as aforesaid, the notice is hereby given to the above borrowers, co-borrowers and/ or their guarantors (where ever applicable) to pay the outstanding dues as mentioned above along with future interest and applicable charges within 60 days from the date of the publication of this notice failing which further steps will be taken after the expiry of 60 days of the date of this notice against the secured assets including taking possession of the secured assets of the borrowers and the mortgagors under Section 13(4) of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and the applicable rules there under.
Please note that under Section 13 (13) of the said Act, no Borrower shall, transfer by way of sale, lease or otherwise any of his secured assets referred to in the notice, without prior written consent of the secured creditor.
Place: Ahmedabad Sd/- Authorised Officer
Date: 16-02-2024 Shriram Finance Ltd

S&P Global India launches the 'India Research Chapter'



Ahmedabad, S&P Global (NYSE: SPGI) today announced the launch of the 'India Research Chapter,' an initiative to fuel India-oriented research and reports. This initiative brings together experts from across divisions and functions of S&P Global and CRISIL (An S&P Global company). As part of the S&P Global India Leadership Council, the newly unveiled India Research Chapter will be guided by a team of experts covering a wide array of themes including economics, technology, generative AI, banking, finance, automotive, country

Bank of Maharashtra to increase Guj biz

Ahmedabad: Public sector lender, Bank of Maharashtra, is looking to increase its business in Gujarat by about 66% by the end of the fiscal year 2024-25, according to Asheesh Pandey, executive director, Bank of Maharashtra. Pandey was in Gujarat on Saturday to inaugurate two new branches of the bank, one in Ahmedabad and another in Vadodara. "Currently, we have a business worth Rs 12,000 crore in Gujarat which we want to raise to Rs 15,000 crore by the June quarter and to Rs 20,000 crore over the subsequent nine months of the fiscal year 2024-25," Pandey told.

MAITRI ENTERPRISES LIMITED

(CIN:L45208GJ1991PLC016853)
(Regd. Office:- "Gayatri House", Ashok Vihar, Near Maitri Avenue Society, Opp. Govt. Eng. College, Motera, Sabarmati, Ahmedabad 380005)
Phone No. 079-27506840/27571340 E-mail id: compliance@maitrienterprises.com, website:www.maitrienterprises.com

Extract of Consolidated Un-Audited Financial Results for the Quarter and Nine Months ended December 31, 2023

Particulars	Quarter Ended		Nine Months Ended	
	31-12-2023 (Unaudited)	31-12-2022 (Unaudited)	31-12-2023 (Unaudited)	31-03-2023 (Audited)
Total income from operations (net)	669.53	313.80	1346.54	1343.87
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	27.57	(11.39)	28.05	16.50
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	27.57	(11.39)	28.05	16.50
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	8.89	(11.75)	9.37	(0.11)
Total Comprehensive income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	8.89	(11.75)	9.37	(0.11)
Equity Share Capital	440.00	440.00	440.00	440.00
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)				56.84
Earnings Per Share (of Re.1/- each)(for continuing and discontinued operations)				
Basic :	0.20	(0.27)	0.21	(0.01)
Diluted:	0.20	(0.27)	0.21	(0.01)

Extract of Standalone Un-Audited Financial Results for Quarter and Nine Months ended December 31, 2023

Particulars	Quarter Ended		Nine Months Ended	
	31/12/2023 (Unaudited)	31-12-2022 (Unaudited)	31-12-2023 (Unaudited)	31-03-2023 (Audited)
Total income from operations	644.90	256.64	1263.61	993.38
Profit Before Tax	35.85	1.43	52.01	46.77
Profit After Tax (After Other Comprehensive Income)	17.17	1.07	33.33	33.72

The above is an extract of the detailed format of Quarterly Financial Results for the Quarter and Nine Months ended on 31st December, 2023 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Company i.e. www.maitrienterprises.com and on the website of BSE Ltd (www.bseindia.com)

For Maitri Enterprises Limited
SD/-
Mr. Jaikishan Ambwani
Managing Director
(DIN:03592680)
Date: 14-02-2024
Place: Ahmedabad

